

B.Ed. Semester - 1 (CBCS) Examination
January -2019 (New Course)
Accountancy Content (SSC 1.5)

Time: 2:30 Hours

Marks: 35

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-1 નીચેના પ્રત્યેક પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો. (05)
- (1) જવાબદારીના પ્રકારો જણાવો.
 - (2) રોકડ વ્યવહાર એટલે શું?
 - (3) આમનોંધને નામાનો પ્રથમ ચોપડો શા માટે કહે છે?
 - (4) પેટાનોંધોનાં કેટલા અને કયા પ્રકાર છે?
 - (5) પેટા રોકડમેળનો અર્થ સમજાવો.
- પ્રશ્ન-2 નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોનાં જવાબ આપો. (10)
- (1) ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારોનું વર્ગીકરણ સમજાવો.
 - (2) ખાતાવહી એટલે શું? તેની જરૂરિયાત વિશે માહિતી આપો.
 - (3) કાચા સરવૈયાનાં બે લક્ષણો સમજાવો.
 - (4) બેન્ક સિલકમેળમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે?
 - (5) આર્થિક અને બિનઆર્થિક વ્યવહાર વચ્ચેનો તફાવત આપો.
 - (6) હિસાબી પદ્ધતિની મર્યાદાઓ કઈ કઈ છે?
- પ્રશ્ન-3 નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોનાં વિસ્તૃત જવાબ આપો. (20)
- (1) શ્રી માહિન પટેલએ શરૂ કરેલ પટેલ ટ્રેડર્સનાં ધંધાના વ્યવહારો પરથી આમનોંધ લખો.
 2015:
 જુલાઈ-1. રૂ.50,000 રોકડા, રૂ.20,000નાં દેવાદારો, રૂ.10,000નો માલ સ્ટોક તથા રૂ.5000નાં લેણદારો લાવી ધંધો શરૂ કર્યો.
 11. માલનાં પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી રૂ.200 ચૂકવ્યા.
 12. પગાર-મજૂરીના રૂ.2000 ચેકથી ચૂકવ્યા.
 25. AXIS બેન્કની લોન પર રૂ.250 વ્યાજ બેન્કે વસૂલ કર્યું.
 (2) રોકડમેળ મુજબ બેન્કસિલક અને પાસબુક મુજબ બેન્કસિલક વચ્ચે તફાવતનાં કારણો જણાવો.
 (3) નીચેના વ્યવહારો પરથી રાજવી ટ્રેડર્સનાં ચોપડે રોકડ અને બેન્ક ખાતાવાળી રોકડમેળ તૈયાર કરો.
 2016:
 જૂન-1. શરૂઆતની રોકડસિલક રૂ.5000, શરૂનો બેન્ક ઓવરડ્રાફ્ટ રૂ.1500.
 3. રૂ.8000નો માલ 10 ટકા વેપારીવટાવે રોકડેથી જાનકીને વેચ્યો.
 5. રૂ.3000 રોકડા બેન્કમાં ભર્યા.
 18. પગારનાં રૂ.1000 અને દલાલીનાં રૂ.500 રોકડેથી ચૂકવી આપ્યા.

- (4) નીચે આપેલ વિગતોનાં આધારે કીર ભટ્ટનું તા.31-3-2015નાં રોજ પૂરા થતાં વર્ષનું કાચું સરવૈયું તૈયાર કરો.

ખાતાનું નામ	રકમ રૂ.	ખાતાનું નામ	રકમ રૂ.
શરૂઆતનો સ્ટોક	7440	બેન્ક લોન	1760
મજૂરી	4000	આવકમાલ ગાડાભાડું	1200
વેચાણ	48,000	ખરીદી	30,000
સમારકામ	800	જાવકમાલ ગાડાભાડું	600
વેરો	600	દેવાદારો	8000
જમીન-મકાન	2400	રોકડસિલક	80
પ્લાન્ટ મશીનરી	3000	છૂટા ઓજારો	720
વીજળી ખર્ચ	920	લેણદારો	3200
મૂડી	16000	પરચૂરણ આવકો	240
ઓફિસ પગાર	1000	ઓફિસ ફર્નિચર	240
પેટન્ટ	400	પાઘડી	6000
બેન્કસિલક	1800		

- (5) નીચેના વ્યવહારો શ્રી હીરેન પટેલની ખાસ આમનોંધમાં નોંધો.

1. રૂ.5000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો.
2. રૂ.4000નો માલ નમૂના તરીકે મફત વહેંચ્યો.
3. રૂ.8000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા.
4. રૂ.3000નું ફર્નિચર, રૂ.2800નો માલ આપી ખરીદ્યું.

- (6) ખરીદનોંધ અને તેના પ્રકારો નમૂના સહિત સમજાવો.

ENGLISH VERSION

- Que-1 Answer the following question in short. (05)
- (1) State the types of liabilities.
 - (2) What is cash transaction?
 - (3) Why Journal is known as the first book of accounts?
 - (4) How many types of Subsidiary books are there?
 - (5) Explain the meaning of petty cash book.
- Que-2 Answer any five of the following questions. (10)
- (1) Explain the classifications of the transactions recorded in the Journal Proper.
 - (2) What is a ledger? Give the information regarding its utility.
 - (3) Explain two features of trial balance.
 - (4) Which transactions are recorded in a bank reconciliation statement?
 - (5) Distinguish between economic and non economic transaction.
 - (6) What are the limitations of accounting?
- Que-3 Answer any five of the following questions in detail. (20)
- (1) Write Journal entry of business commenced by Shri Mahin Patel with a name of Patel traders:
2015
July-1. Brought Rs.50,000 cash, debtors Rs.20,000, stock of goods Rs.10,000 and creditors of Rs.5000 and commenced business.
11. Purchased plastic bags of Rs.200 for goods packing by cash.
12. Rs.2000 paid by Cheque for salary and wages.
25. Axis Bank has charged loan interest of Rs.250.
 - (2) State reasons for difference between balance as per cashbook and passbook.
 - (3) From the following transactions, prepare cash and bank columnar cash book in the books of Rajvi traders:
2016:
June-1. Opening cash balance Rs.5000, opening bank overdraft Rs.1500.
3. Goods of Rs.8000 sold to Janki at 10% trade discount for cash.
5. Rs.3000 deposited in the bank.
18. Salary of Rs.1000 and brokerage of Rs.500 are paid by cash.
 - (4) From the given information prepare trial balance of **Pravin Patel** as on 31-3-2015.
- | Name of A/c. | Amount
Rs. | Name of A/c. | Amount
Rs. |
|----------------------|---------------|------------------|---------------|
| Opening stock | 7440 | Bank loan | 1760 |
| Wages | 4000 | Carriage inward | 1200 |
| Sales | 48,000 | Purchase | 30,000 |
| Repairing | 800 | Carriage outward | 600 |
| Tax | 600 | Debtors | 8000 |
| Land-building | 2400 | Cash balance | 80 |
| Plant-machinery | 3000 | Loose tools | 720 |
| Electricity expenses | 920 | Creditors | 3200 |
| Capital | 16000 | Sundry incomes | 240 |
| Office salary | 1000 | Office furniture | 240 |
| Patent | 400 | Goodwill | 6000 |
| Bank balance | 1800 | | |
- (5) Record the following transactions in the journal proper of Hiren Patel.
 1. Gave goods of Rs.5000 to Anath Ashram.
 2. Distributed goods of Rs.4000 as free Samples.
 3. Withdrew goods of Rs.8000 from the business for the personal use.
 4. Purchased furniture of Rs.3000 by giving goods of Rs.2800.
 - (6) Explain the purchase book and types of purchase book with example.
